

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલીફોન નંબર ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૧/૧૧/૨૦૧૬ સોમવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

શહેર પોલીસ ધ્વારા કરવામાં આવેલ

પ્રશંસનીય/નોંધપાત્ર કામગીરી:-

સમાચાર યાદી નં.૨૧૫૩/૧૬

રામોલ પોલીસ સ્ટેશન :

મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી 'આઈ' ડીવીઝન અમદાવાદ શહેર તથા પો.ઇન્સ.શ્રી રામોલ પો.સ્ટે.નાઓની સુચનાથી ગઇ તા.૧૬/૧૧/૧૬ ના રોજ રામોલ પો.સ્ટે.ના સવેલન્સ સ્કોર્ડના પો.સ.ઇ.શ્રી કે.એન.લાઠીયાનાઓ સાથેના સ્ટાફના માણસો સાથે મિલકત સંબંધી ગુના શોધી કાઢવા તથા બનતા અટકાવવા સારુ તથા રામોલ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૮૩/૧૬ ઇપીકો ક.૩૭૯ મુજબના ગુનાની તપાસમાં પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન વસ્ત્રાલ ગેલેક્ષી કોરલ મેદાન સામે આવતાં સાથેના પો.કો.હિતેશકુમાર મોહનલાલ બ.નં.૩૦૨૪ તથા પો.કો.હરેશભાઈ જેઠાભાઈ બ.નં.૩૫૭૭ નાઓએ સંયુક્ત બાતમી હકિકત આપેલ કે, રામોલ પો.સ્ટે.ફ.૧૮૩/૧૬ ઇપીકો ક.૩૭૯ મુજબના કામે ચોરીએ ગયેલ મો.સા.નં.જીજે.૨૭.ઇ.૪૮૫૫ નુ લઇ એક ઇસમ રીંગરોડ તરફથી લઇ આવી અત્રે થઇ પસાર થનાર છે જે બાતમી હકિકત આધારે રસ્તે જતા બે પંચો બોલાવી પંચો સાથે ઉપરોક્ત જગ્યાએ ઉપરોક્ત નંબરના મો.સા.ની વોચમાં ઉભા હતા તે દરમ્યાન થોડીવારમાં એક ઇસમ પોતના કબજામાં ઉપરોક્ત નંબરનુ મો.સા.લઇ આવતાં તેને પંચો રુબરુ ઉભો રાખી તેનુ નામઠામ પુછતા તેને પોતાનુ નામ મનોજકુમાર દર્શનલાલ શર્મા ઉ.વ.૪૫ રહે.મ.નં.૧૯૧ યમુના પાર્ક રોયલ રેસ્ટોરન્ટ સામે આદીનાથનગર ઓઢવનુ જણાવતાં તેની પાસેના મો.સા.નં.જીજે.૨૭.ઇ. ૪૮૫૫ ની માલિકી બાબતે પુછપરછ કરતાં કોઇ સંતોષ કારક જવાબ નહી આપી કોઇ આધાર પુરાવા નહી આપતાં ગલ્લા તલ્લા કરતાં સદર ઇસમને વિશ્વાસમાં લઇ પુછપરછ કરતાં સદર મો.સા.ગઇ તા.૧૪/૧૧/૧૬ ના રોજ સાંજના સમયે વસ્ત્રાલ ચાર રસ્તા પાસે આવેલ પુષ્પ કોમ્પલેક્ષ ની સામે ખુલ્લી જગ્યામાંથી ચોરી કરેલાનુ જણાવતાં સદરી ચોરી બાબતે તપાસ કરતાં રામોલ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૮૩/૧૬ ઇપીકો ક.૩૭૯ મુજબનો ગુનો દાખલ થયેલ હોય સદર મો.સા.ને કબજે લઇ આરોપીને તા.૧૬/૧૧/૧૬ ના ક.૨૦/૦૦ વાગે અટક કરી વાહન ચોરીનો અનડીટેકટ ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.